



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ
યુ.સી.ડી ભવન, પરિક્ષીતલાલ નગર રોડ, બહેરામપુરા,
અમદાવાદ - ૩૮૦૦૨૨, ફોન - ૦૭૯-૨૫૩૩૧૨૦૧



સુધારા જાહેરાત

મુખ્યમંત્રી એપ્રેન્ડીસશીપ યોજના હેઠળ એપ્રેન્ડીસ ભરતી કરવા અંગે

તા.૨૩-૦૮-૨૦૨૨ ના રોજ યુ. સી. ડી ખાતા મારફતે પ્રસિધ્ધ થયેલ જાહેરાત માં ટ્રેડના પ્રકારમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવેલ છે અન્ય તમામ બાબતો યથાવત રહેશે.

ક્રમ	જાહેરાતમાં આપેલ ટ્રેડ	સુધારા જાહેરાતમાં આપેલ ટ્રેડ
૧	માઈક્રો ફાયનાન્સ એપ્રેન્ડીસ	એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ (Accounts Executive)
૨	લોન પ્રોસેસિંગ એપ્રેન્ડીસ	ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેક ઓફિસ) Office Operations Executive(Back Office)

ડે.મ્યુનિસિપલ કમિશનર
(યુ.સી.ડી)



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ

યુ.સી.ડી ભવન, પરિક્ષિતલાલ નગર રોડ, બહેરામપુરા,

અમદાવાદ - ૩૮૦૦૨૨, ફોન - ૦૭૯-૨૫૩૩૧૨૦૧



ધી એપ્રેન્ટીસ એક્ટ - ૧૯૬૧ હેઠળ નીચે જણાવેલ ટ્રેડમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવા નિયત અરજીપત્રકમાં જાહેરાત પ્રસિધ્ધ થયાને તા.૦૩-૦૯-૨૦૨૨ સુધીમાં વર્તમાન પત્રમાં જણાવેલ સ્થળ સ્થળ ઉપર અરજી જમા કરાવવા જણાવવામાં આવે છે.

ક્રમ	ટ્રેડ	ટ્રેડનો પ્રકાર	સંખ્યા	લાયકાત	સમયગાળો	સ્ટાઈપેન્ડ/માનદ વેતન
૧	માઈક્રો ફાયનાન્સ એપ્રેન્ટીસ	Optional Trade	૫૦	માન્ય સંસ્થાનાં કોઈપણ ગ્રેજ્યુએટ	૧ વર્ષ	૯૦૦૦/- (પ્રતિ માસ)
૨	લોન પ્રોસેસિંગ એપ્રેન્ટીસ	Optional Trade	૫૦	માન્ય સંસ્થાનાં કોઈપણ ગ્રેજ્યુએટ	૧ વર્ષ	૯૦૦૦/- (પ્રતિ માસ)

આ એપ્રેન્ટીસ ટ્રેડની જાહેરાત અન્વયે અરજી કરતાં પહેલા વિગતવાર જાહેરાતની સામાન્ય સૂચનાઓ અને અરજી કરવાની રીત અંગેની માંહીતી નીચે મુજબ જોવી ત્યારબાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે.

અરજીકરનાર માટે સામાન્ય સૂચનાઓ.

- (૧) સૌ પ્રથમ <https://apprenticeshipindia.org> ઉપર જઈ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી તમારું ફોર્મ સંપૂર્ણ ભરવું.
- (૨) ત્યારબાદ Apprenticeship Opportunities માં જઈ Search By Establishment Name માં જઈ urban Community Development Department type કરી search કરવું ત્યારબાદ બાજુ માં Trade show થશે જેમાં જે ટ્રેડમાં Apply કરવું હોઈ તે Apply બટન પર ફરજિયાત ક્લિક કરવું.
- (૩) ત્યારબાદ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ ફોર્મની પ્રોફાઇલ પ્રિન્ટ અને આ સાથે આપેલ અરજી પત્રકમાં એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન નંબર ફરજિયાત લખવો અને અરજી ફોર્મ સ્વહસ્તે ભર્યા બાદ તેમાં જણાવેલ જરૂરી આધાર પુરાવાઓની પ્રમાણિત નકલો સામેલ કરી અરજી જાહેરાત માં જણાવેલ સ્થળ ઉપર જાહેરાતમાં આપેલ તારીખ સુધીમાં અરજી જમા કરાવવાની રહેશે.
- (૪) જો કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરારથી જોડાયેલ હશે તો તેઉમેદવારની અરજી રદ થવા પાત્ર થશે.
- (૫) સદર અરજીપત્રક સિવાયની અન્ય ફોર્મેટમાં મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં અને રદબાતલ ગણાશે.
- (૬) ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં.

- (૭) માર્કશીટ ડિગ્રી સર્ટીફિકેટ માં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજુ કરવાનું રહેશે.
- (૮) એપ્રેન્ટીસને ધી એપ્રેન્ટીસશીપ એક્ટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. તેમજ લાગુ પડતા ટ્રેડ મુજબ ના તાલીમાર્થીઓ પ્રમાણપત્રને લાયક રહેશે.
- (૯) ઉમેદવારો એ ફોર્મમાં પોતાનો મોબાઈલ નંબર લખવો અનિવાર્ય છે, જે ઉપર ભવિષ્યમાં ભરતી અંગે સંદેશ આપી શકાય. આપેલ નંબર ખોટો અથવા બંધ હશે તો તેની કોઈ જવાબદારી અ.મ્યુ.કોની રહેશે નહીં.
- (૧૦) એપ્રેન્ટીસને ધી એપ્રેન્ટીસશીપ એક્ટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. તેમજ લાગુ પડતા ટ્રેડ મુજબ ના તાલીમાર્થીઓ પ્રમાણપત્રને લાયક રહેશે.
- (૧૧) આ જાહેરાત ફક્ત એપ્રેન્ટીસશીપ માટે છે. એપ્રેન્ટીસશીપ નો તાલીમ સમયગાળો પૂર્ણ થયેથી એપ્રેન્ટીસને તુર્ત જ છૂટા કરવામાં આવશે.
- (૧૨) આ જાહેરાત કોઈપણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો મ્યુનિ. કમિશનરશ્રી ને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવામાં આવશે નહીં.

ડાયરેક્ટરશ્રી
યુ.સી.ડી વિભાગ
અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન